

## જીવદ્વાર

(૧)

ચિદાનંદ ભગવાનની સ્તુતિ (દોહરા)

શોભિત નિજ અનુભૂતિ જુત ચિદાનંદ ભગવાન ।  
સાર પદારથ આત્મા, સકલ પદારથ જાન ॥૧॥

**શાન્દાર્થ :**—નિજ અનુભૂતિ = પોતાના આત્માનું સ્વસંવેદન શાન. ચિદાનંદ (ચિત્ત+આનંદ) = જેને આત્મિક આનંદ હોય.

**અર્થ :**—તે ચિદાનંદ પ્રભુ પોતાના સ્વાનુભવથી સુશોભિત છે. સર્વ પદાર્થોમાં સારભૂત આત્મપદાર્થ છે અને સર્વ પદાર્થોનો જ્ઞાતા છે. ૧.

સિદ્ધ ભગવાનની સ્તુતિ, જેમાં આત્માનું વર્ણન છે.

સિદ્ધ (સવૈયા તેવીસા) ચિદાનંદ.

જો અપની દુતિ આપ વિરાજત,  
હે પરધાન પદારથ નામી ।  
ચેતન અંક સદા નિકલંક,  
મહા સુખ સાગરકૌ વિસરામી ॥

- નીચે ટિપ્પણીમાં જે શ્લોક આપવામાં આવ્યા છે તે શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્ય રચિત નાટક સમયસાર કળશના શ્લોક છે. જે શ્લોકોનો પં. બનારસીદાસજીએ પદ્ધાનુવાદ કર્યો છે.

નમ: સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ।  
ચિત્તસ્વભાવાય ભાવાય સર્વભાવાન્તરચિદે ॥૧॥

જીવ અજીવ જિતે જગમૈ,  
તિનકૌ ગુન જ્ઞાયક અંતરજામી ।  
સો સિવરૂપ બસૈ સિવ થાનક,  
તાહિ વિલોકિ નમૈ સિવગામી ॥૨॥

**શાસ્ત્રાર્થ :** :- દુતિ(ધુતિ) = જ્યોતિ. વિરાજિત = પ્રકાશિત. પરધાન = પ્રધાન. વિસરામી (વિશ્રામી) = શાન્તરસનો ભોક્તા. શિવગામી = મોક્ષે જનાર સમ્યંદષ્ટિ, શ્રાવક, સાધુ, તીર્થકર આદિ.

અર્થ :—જે પોતાના આત્મજ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત છે, સર્વ પદાર્થોમાં મુખ્ય છે, જેમનું ચૈતન્ય-ચિહ્ન છે, જે નિર્વિકાર છે, બહુ મોટા સુખસમુક્રમાં આનંદ કરે છે, સંસારમાં જેટલા ચૈતન-અચૈતન પદાર્થ છે તેમના ગુણોના જ્ઞાતા, ઘટઘટને જ્ઞાનાર છે તે સિદ્ધભગવાન મોક્ષરૂપ છે, મોક્ષપુરીના નિવાસી છે, તેમને મોક્ષગામી જીવ જ્ઞાનદષ્ટિથી જોઈને નમસ્કાર કરે છે. ૨

જિનવાણીની સ્તુતિ (સવૈયા તેવીસા)

જોગ ધરૈ રહૈ જોગસોં ભિન્ન,  
અનંત ગુનાતમ કેવલજ્ઞાની ।  
તાસુ ~~H~~ હૃદૈ-દ્રહસોં નિકસી ~~સ્તુતિ~~.  
સરિતાસમ હૈ શ્રુત-સિંધુ સમાની ॥  
યાતે અનંત નયાતમ લચ્છન,  
સત્ય સ્વરૂપ સિધંત બખાની ।  
બુદ્ધ લખૈ ન લખૈ દુરખુદ્ધ,  
સદા જગમાંહિ જગૈ જિનવાની ॥૩॥

**શાસ્ત્રાર્થ :-** હૃદૈ-દ્રહસોં=હૃદયરૂપી સરોવરમાંથી. બુદ્ધ=પવિત્ર, જૈનધર્મના વિદ્વાન.

અનન્તર્ધર્મણસ્તત્ત્વं પશ્યત્તી પ્રત્યગાત્મનः ।  
અનેકાન્તમરી મૂર્તિનિત્યમેવ પ્રકાશતામ् ॥૨॥

દુરભૂષ=મિથ્યાદટિ, કોરા વ્યાકરણ, કોષ આદિના શાતા પરંતુ નયજ્ઞાન રહિત. ૧

**અર્થ :**—અનંત ગુણોના ધારક કેવળજ્ઞાની ભગવાન જો કે સયોગી<sup>૨</sup> છે તોપણ યોગોથી પૃથક છે. તેમના હદ્યરૂપ સરોવરમાંથી નદીરૂપ જિનવાણી નીકળીને શાસ્ત્રરૂપ સમુદ્રમાં પ્રવેશી ગઈ છે, તેથી સિદ્ધાંતમાં એને સત્યસ્વરૂપ અને અનંતનયાત્મક કહેલ છે. એને જૈનધર્મના મર્મી સમ્યાદાણિ જીવ ઓળખે છે, મૂર્ખ મિથ્યાદાણિ જીવો સમજતા નથી. આવી જિનવાણી જગતમાં સદા જ્યવંત હો! ૩.

## કવિ વ્યવસ્થા (ઇન્ડ ઇયા)

हैं निहचै तिहुंकाल, सुद्ध चेतनमय मूरति।  
पर परनति संजोग, भई जड़ता विसफूरति ॥

मोहकर्म पर हेतु पाइ, चेतन पर रचइ।  
ज्यौं धतूर-रस पान करत, नर बहुविध नचइ ॥

अब समयसार वरनन करत,  
परम सुद्धता होहु मुझ।

अनयास बनारसिदास कहि,  
मिटहु सहज भ्रमकी अरुज ॥४॥

**શાન્દાર્થ** :—પર પરણતિ=પોતાના આત્મા સિવાય અન્ય ચેતન-અચેતન પદાર્થમાં અહંકૃતિ અને રાગ-દ્વારા વિસ્ક્રિત(વિસ્ક્રિત)=જાગ્રત. તિંહુંકાળ=ત્રણે કાળ(ભૂત, વર્તમાન, ભવિષ્ય) રચ્યાઈ=રાગ કરવો. નચ્યાઈ=નાયવું. અનાયાસ=ગ્રંથ ભણવા વગેરેનો પ્રયત્ન કર્યા વિના. અસુઝ=ગ્રંથવણ.

૧. આવા લોકોને આદિપુરાણમાં અક્ષર-મ્લેચ્છ કહ્યા છે. ૨. તેરમાં ગુણસ્થાનમાં મન, વચન, કાયાના સાત યોગ કહ્યા છે પરંતુ યોગો દ્વારા જ્ઞાનનો અનુભવ કરતા નથી.

परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावा-

दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः ।

मम परमविशद्धिः शुद्धचिन्मात्रमृते-

भवत् समयसारव्याख्यैवानुभूतेः ॥३॥

અર્થ :-હું નિશ્ચયથી સદાકાળ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું, પરંતુ પર પરિણાતિના સમાગમથી અજ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે. મોહકર્મનું પર નિમિત્ત પામીને આત્મા પર પદાર્થમાં અનુરાગ કરે છે, એથી ધતૂરાનો રસ પીને નાચનાર મનુષ્ય જેવી દશા થઈ રહી છે. પં. બનારસીદાસજી કહે છે કે હવે સમયસારનું વર્ણન કરવાથી મને પરમ વિશુદ્ધિ પ્રાપ્ત થાવ અને વિના પ્રયત્ને જ મિથ્યાત્વની ગુંચવણ પોતાની મેળે મટી જાવ. ૪.

શાસ્ત્રનંનું માહાત્મ્ય (સવૈયા તેવીસા)

નિહચૈમૈં રૂપ એક વિવહારમૈં અનેક,  
યાહી નૈ-વિરોધમૈં જગત ભરમાયૌ હૈ।  
જગકે વિવાદ નાસિબેકોં જિન આગમ હૈ,  
જામૈં સ્યાદ્વાદનામ લચ્છન સુહાયૌ હૈ॥  
દરસનમોહ જાકૌ ગયૌ હૈ સહજરૂપ,  
આગમ પ્રમાન તાકે હિરદૈમૈં આયો હૈ॥  
અનૈસોં અખંડિત અનૂતન અનંત તેજ,  
એસો પદ પૂરન તુરંત તિનિ પાયૌ હૈ॥૫॥

શાસ્ત્રાર્થ :-નૈ=નય. દરશનમોહ(દર્શનમોહ)=જેના ઉદ્દ્યમાં જીવ તત્ત્વ-શ્રદ્ધાનથી પડી જાય છે. પદ પૂરન(પૂર્ણપદ)=મોક્ષ

અર્થ :-નિશ્ચયનયમાં પદાર્થ એકરૂપ છે અને વ્યવહારમાં અનેકરૂપ છે. આ નય-વિરોધમાં સંસાર ભૂલી રહ્યો છે, તેથી આ વિવાદને નાચ કરનાર જિનાગમ છે

૧. મહોર-છાપ લાગી છે—સ્યાદ્વાદથી જ ઓળખવામાં આવે છે આ જિનાગમ છે.

ઉભયનયવિરોધધર્ઘંસિનિ સ્યાત્પદાંકે  
જિનવચસિ રમન્તે યે સ્વયં વાન્તમોહાઃ ।  
સપદિ સમયસારં તે પરં જ્યોતિરુચ્ચૈ-  
રનવમનયપક્ષાકુર્ણમીક્ષન્ત એવ ॥૪॥

જેમાં સ્યાદ્વાદનું શુભ<sup>૧</sup> ચિહ્ન છે. જે જીવને દર્શનમોહનો ઉદ્ય હોતો નથી તેના હૃદયમાં હોતો નથી તેના હૃદયમાં સહજ સ્વભાવથી આ પ્રામાણિક જ્ઞાનાગમ પ્રવેશ કરે છે અને તેને તત્કાળ જ નિત્ય, અનાદિ અને અનંત પ્રકાશવાન મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ૫.

નિશ્ચયનયની પ્રધાનતા (સવૈયા તેવીસા)

જ્યોં નર કોડ ગિરે ગિરિસોં તિહિ,  
સોઇ હિતૂ જો ગહૈ દિઢ્બાહીં ।  
ત્યોં બુધકોં વિવહાર ભલૌ,  
તવલોં જવલોં શિવ પ્રાપતિ નાહીં ॥  
યદ્યપિ યૌં પરવાન તથાપિ,  
સધૈ પરમારથ ચેતનમાહીં ।  
જીવ અવ્યાપક હૈ પરસોં,  
વિવહારસોં તૌ પરકી પરછાહીં ॥૬॥

**શાસ્ત્રાર્થ :-** ગિરિસોં=પર્વત પરથી. બાહીં=હાથ. બુદ્ધ=શાની, પ્રાપતિ=પ્રાપ્તિ.

**અર્થ :-**—જેમ કોઈ મનુષ્ય પહાડ ઉપરથી લપસી જાય અને કોઈ હિતકારી બનીને તેનો હાથ મજબૂતાઈથી પકડી લે તેવી જ રીતે જ્ઞાનીઓને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી વ્યવહારનું અવલંબન છે, જો કે આ વાત સાચી છે તોપણ નિશ્ચયનય ચૈતન્યને સિદ્ધ કરે છે તથા જીવને પરથી ભિન્ન દર્શાવે છે અને વ્યવહારનય તો જીવને પરને આશ્રિત કરે છે.

**ભાવાર્થ :-**—જો કે ચોથા ગુણસ્થાનથી ચોદમા ગુણસ્થાન સુધી વ્યવહાર હોય છે, પરંતુ ઉપાદેય તો નિશ્ચયનય જ છે, કારણ કે તેનાથી પદાર્થનું અસલી સ્વરૂપ જાણવામાં

વ્યવહરણનય: સ્યાધ્યાપિ પ્રાક્પદવ્યા-  
મિહ નિહિતપદાનાં હન્ત હસ્તાવલમ્બ: ।  
તદપિ પરમર્મર્થ ચિદ્યમત્કારમાત્ર  
પરવિરહિતમન્ત: પશ્યતાં નૈષ કિંચિત ॥૫॥

આવે છે અને વ્યવહારનય અભૂતાર્થ હોવાથી પરમાર્થ પ્રયોજનભૂત નથી. ૬.

સમ્યગદર્શનનું સ્વરૂપ (સવૈયા એકગ્રીસા)

શુદ્ધનય નિહચૈ અકેલો આપુ ચિદાનંદ,  
અપનૈહી ગુણ પરજાયકૌં ગહતુ હૈ।  
પૂરન વિગ્યાનઘન સો હૈ વિવહારમાંહિ,  
નવ તત્ત્વરૂપી પંચ દર્વ મૈં રહતુ હૈ॥  
પંચ દર્વ નવ તત્ત્વ ન્યારે જીવ ન્યારૌ લખૈ,  
સમ્યકદરસ યહૈ ઔર ન ગહતુ હૈ।  
સમ્યકદરસ જોઈ આતમ સરૂપ સોઈ,  
મેરે ઘટ પ્રગટો બનારસી કહતુ હૈ॥૭॥

શાન્દાર્થ :— <sup>૧</sup>લખૈ=શ્રદ્ધા કરે. ઘટ=હઠય. ગહતુ હૈ=ધારણા કરે છે.

અર્થ :—શુદ્ધ નિશ્ચયનયથી ચિદાનંદ એકલો જ છે અને પોતાના ગુણ-પર્યાયોમાં પરિણમન કરે છે. તે પૂર્ણજ્ઞાનનો પિંડ <sup>૨</sup>પાંચ દ્રવ્ય, નવ તત્ત્વમાં રહ્યો છે એમ વ્યવહારથી કહેવાય છે. પાંચ દ્રવ્ય અને નવ તત્ત્વોથી ચેતયિતા ચેતન નિરાળો છે, એવું શ્રદ્ધાન કરવું અને એના સિવાય બીજી રીતે શ્રદ્ધાન ન કરવું તે સમ્યગદર્શન છે અને સમ્યગદર્શન જ આત્માનું સ્વરૂપ છે. પં. બનારસીદાસજી કહે છે કે તે સમ્યગદર્શન

૧. લખન, દર્શન, અવલોકન આદિ શબ્દોનો અર્થ જૈનાગમમાં ક્યાંક તો ‘જોવું’ થાય છે જે દર્શનાવરણી કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે અને ક્યાંક આ શબ્દોનો અર્થ ‘શ્રદ્ધાન કરવું’ લેવામાં આવે છે જે દર્શનમોહના અનુદ્યની અપેક્ષાએ છે, અહીં દર્શનમોહના અનુદ્યનું જ પ્રયોજન છે.
૨. જૈનાગમમાં જ દ્રવ્ય કહ્યાં છે, પણ અહીં કાળ દ્રવ્યને ગૌણ કરીને પંચાસ્તિકાયને જ દ્રવ્ય કહેલ છે.

એકત્વે નિયતસ્ય શુદ્ધનયતો વ્યાસુર્યદસ્યાત્મન:  
પૂર્ણજ્ઞાનઘનસ્ય દર્શનમિહ દ્રવ્યાન્તરેભઃ પૃથક् ।  
સમ્યગદર્શનમેતદેવ નિયમાદાત્મા ચ તાવાનયમુ  
તનુક્ત્વા નવતત્ત્વસત્તતિમિમામાત્માયમેકોઽસ્તુ નઃ ॥૬॥

અર્થાત् આત્માનું સ્વરૂપ મારા હંદ્યમાં પ્રગટ થાવ. ૭.

જીવની દશા પર અભિનનું દષ્ટાંત (સવૈયા એકત્રીસા)

જૈસેં તૃણ કાઠ બાંસ આરને ઇત્યાદિ ઔર,  
ઈધન અનેક વિધિ પાવકમેં દહિયે ।  
આકૃતિ વિલોકિત કહાવૈ આગ નાનારૂપ,  
દીસૈ એક દાહક સુભાવ જબ ગહિયે ॥  
તૈસેં નવ તત્ત્વમેં ભયો હૈ બહુ ભેષી જીવ,  
સુદ્ધરૂપ મિશ્રિત અસુદ્ધ રૂપ કહિયે ।  
જાહી છિન ચેતના સકતિકૌ વિચાર કિજૈ,  
તાહી છિન અલખ અભેદરૂપ લહિયે ॥૮॥

શાસ્ત્રાર્થ :— આરને=જંગલના. દાહક=બાળનાર. અલખ=અરૂપી. અભેદ=ભેદવ્યવહારથી રહિત.

અર્થ :—જેવી રીતે ઘાસ, લાકડા, વાંસ અથવા જંગલના અનેક ઈધન આદિ અભિનમાં બળે છે, તેમના આકાર ઉપર ધ્યાન દેવાથી અભિન અનેકરૂપ દેખાય છે, પરંતુ જો માત્ર દાહક સ્વભાવ ઉપર દષ્ટિ મૂકવામાં આવે તો સર્વ અભિન એકરૂપ જ છે, તેવી જ રીતે જીવ (વ્યવહારનયથી) નવ તત્ત્વોમાં શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર આદિ અનેકરૂપ થઈ રહ્યો છે, પરંતુ જ્યારે તેની ચૈતન્યશક્તિ પર વિચાર કરવામાં આવે છે ત્યારે તે (શુદ્ધનયથી) અરૂપી અને અભેદરૂપ ગ્રહણ થાય છે. ૮.

જીવની દશા પર સોનાનું દષ્ટાંત (સવૈયા એકત્રીસા)

જૈસેં બનવારીમેં કુઘાતકે મિલાપ હેમ,  
નાનાભાંતિ ભયો પૈ તથાપિ એક નામ હૈ ।

અતઃ શુદ્ધનયાયત્તં પ્રત્યગ્યોતિશ્કકસ્તિ તત્ ।  
નવતત્ત્વગતત્વે�પિ યદેકત્વં ન મુંચતિ ॥૭॥

કસિકેં કસોટી લીકુ નિરહૈ સરાફ તાહિ,  
 બાનકે પ્રવાન કરિ લેતુ દેતુ દામ હૈ॥  
 તૈસેં હી અનાદિ પુદ્ગલસૌ સંજોગી જીવ,  
 નવ તત્ત્વરૂપમૈં અરૂપી મહા ધામ હૈ।  
 દીસે ઉનમાનસોં ઉદોતવાન ઠૌર ઠૌર,  
 દૂસરૌ ન ઔર એક આત્મા હી રામ હૈ॥૧॥

**શાલાર્થ** :—બનવારી=કુલડી. લીકુ=રેખા. નિરખ=જુઅ છે. બાન=ચમક. પ્રવાન=અનુસાર, પ્રમાણે ઉનમાન(અનુમાન)=સાધનામાં સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે, જેમ કે ધૂમાડાને જોઈને અભિનું જ્ઞાન કરવું તે.

**અર્થ** :—જેમ સોનું કુધાતુના સંયોગથી અભિના તાપમાં અનેકરૂપ થાય છે, પરંતુ તોપણ તેનું નામ એક સોનું જ રહે છે તથા શરાફ કસોટી ઉપર કસીને તેની રેખા જુઅ છે અને તેની ચમક પ્રમાણે કિંમત દે—લે છે; તેવી જ રીતે અરૂપી મહા દીમિવાળો જીવ અનાદિકાળથી પુદ્ગલના સમાગમમાં નવ તત્ત્વરૂપ દેખાય છે, પરંતુ અનુમાન પ્રમાણથી સર્વ અવસ્થાઓમાં જ્ઞાનરૂપ એક આત્મરામ સિવાય બીજું કાંઈ નથી.

**ભાવાર્થ** :—જ્યારે આત્મા અશુભભાવમાં વર્તે છે ત્યારે પાપતત્ત્વરૂપ હોય છે, જ્યારે શુભભાવમાં વર્તે છે ત્યારે પુષ્યતત્ત્વરૂપ હોય છે અને જ્યારે શમ, દમ, સંયમભાવનામાં વર્તે છે ત્યારે સંવરરૂપ હોય છે, એવી જ રીતે ભાવાસ્થાવ, ભાવબંધ આદિમાં વર્તતો તે આસ્થાવ—બંધાદિરૂપ હોય છે તથા જ્યારે શરીરાદિ જડ પદાર્થોમાં અહેંબુદ્ધિ કરે છે ત્યારે જડસ્વરૂપ હોય છે પરંતુ વાસ્તવમાં આ સર્વ અવસ્થાઓમાં તે શુદ્ધ સુવર્ણ સમાન નિર્વિકાર છે. ૮.

ચિરમિતિ નવતત્ત્વચ્છન્નમુન્નીયમાન  
 કનકમિવ નિમગ્ન વર્ણમાલાકલાપે ।  
 અથ સતતવિવિક્ત દૃશ્યતામેકરૂપ  
 પ્રતિપદમિદમાત્મજ્યોતિરુદ્ધોતમાનમ् ॥૮॥

અનુભવની દશામાં સૂર્યનું દષ્ટાંત (સવૈયા એકશીસા)  
 જૈસેં રવિ-મંડલકે ઉદૈ મહિ-મંડલમે,  
 આતપ અટલ તમ પટલ વિલાતુ હૈ।  
 તૈસેં પરમાત્માકૌ અનુભૌ રહત જૌલોં,  
 તૌલોં કહું દુવિધા ન કહું પચ્છપાતુ હૈ॥  
 નયકૌ ન લેસ પરવાનકૌ ન પરવેસ,  
 નિચ્છેપકે વંસકૌ વિધુંસ હોત જાતુ હૈ।  
 જે જે વસ્તુ સાધક હૈને તેઊં તહાં બાધક હૈને,  
 બાકી રાગ દોષકી દસાકી કૌન બાતુ હૈ॥૧૦॥

**શાલાર્થ :-** મહિ-મંડળ=પૃથ્વીતળ. વિલાતુ હૈ=નાશ પામી જાય છે. પરવાન=પ્રમાણ.  
 વંસકો=સમુદ્દરાયનું. પરવેસ (પ્રવેશ)=પહોંચ.

**અર્થ :-** જેવી રીતે સૂર્યના ઉદ્યમાં પૃથ્વી ઉપર તડકો ફેલાઈ જાય છે અને અંધકારનો નાશ થઈ જાય છે, તેવી જ રીતે જ્યાં સુધી આત્માનો અનુભવ રહે છે ત્યાંસુધી કોઈ વિકલ્પ અથવા નય આદિનો પક્ષ રહેતો નથી. ત્યાં નય-વિચારનો લેશ પણ નથી, પ્રમાણની પહોંચ નથી અને નિક્ષેપોનો સમુદ્દરાય નાચ થઈ જાય છે. પહેલાની દશામાં જે જે વાતો સહાયક હતી તે જ અનુભવની દશામાં બાધક થાય છે અને રાગ-દ્રેષ તો બાધક છે જ.

**ભાવાર્થ :-** નય તો વસ્તુનો ગુણ સિદ્ધ કરે છે અને અનુભવ સિદ્ધ વસ્તુનો હોય છે, તેથી અનુભવમાં નયનું કામ નથી; પ્રત્યક્ષ-પરોક્ષ આદિ પ્રમાણ અસિદ્ધ વસ્તુને સિદ્ધ કરે છે ત્યાં અનુભવમાં વસ્તુ સિદ્ધ જ છે માટે પ્રમાણ પણ અનાવશ્યક છે, નિક્ષેપથી વસ્તુની સ્થિતિ સમજવામાં આવે છે ત્યાં અનુભવમાં શુદ્ધ આત્મ-પદાર્થનું ભાન રહે છે માટે નિક્ષેપ

ઉદ્યતિ ન નયશ્રીરસ્તમેતિ પ્રમાણ  
 કવચિદપિ ચ ન વિદ્યો યાતિ નિક્ષેપચક્રમ ।  
 કિમપરમભિદધો ધામ્નિ સર્વકષેડસ્મિન્-  
 અનુભવમુપયાતે ભાતિ ન દૈતમેવ ॥૧॥

પણ નિષ્ઠયોજન છે, એટલું જ નહિ આ ત્રણે અનુભવની દશામાં બાધા કરે છે. પરંતુ તેમને હાનિ કરનાર સમજીને પ્રથમ અવસ્થામાં છોડવાનો ઉપદેશ નથી. કેમકે એમના વિના પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. આ નય આદિ સાધક છે અને અનુભવ સાધ્ય છે, જેમ દંડ, ચક આદિ સાધનો વિના ઘડાની ઉત્પત્તિ નથી થતી. પરંતુ જેવી રીતે ઘટ પદાર્થ સિદ્ધ થયા પછી દંડ, ચક આદિ વિર્દબનારૂપ જ થાય છે તેવી જ રીતે અનુભવ પ્રાપ્ત થયા પછી નય-નિક્ષેપ આદિના વિકલ્પ હાનિકારક છે. ૧૦.

શુદ્ધનયની અપેક્ષાએ જીવનનું સ્વરૂપ (અડિલ)

આદિ અંત પૂર્ણ-સુભાવ-સંયુક્ત હૈ।

પર-સરૂપ-પરજોગ-કલ્પનામુક્ત હૈ॥

સદા એકરસ પ્રગટ કહી હૈ જૈનમૈ।

સુદ્ધનયાતમ વસ્તુ વિરાજે બેનમૈ॥૧૧॥

**શાન્દાર્થ** :— આદિ અંત=સદૈવ. જોગ=સંયોગ. કલ્પનામુક્ત=કલ્પનાથી રહિત.

**અર્થ** :—જીવ, આદિ અવસ્થા નિગોદથી માંડીને અંત અવસ્થા સિદ્ધપર્યાય સુધી પોતાના પરિપૂર્ણ સ્વભાવથી સંયુક્ત છે, પરદ્રવ્યોની કલ્પનાથી રહિત છે, સદૈવ એક ચૈતન્યરસથી સંપત્ત છે એમ શુદ્ધનયની અપેક્ષાએ જિનવાણીમાં કહ્યું છે. ૧૧.

હિતોપદેશ. (૩૧ માત્રા).

સદ્ગુરુ કહૈ ભવ્યજીવનિસૌ,  
તોરહુ તુરિત મોહકી જેલ।

(ઉપજાતિ)	આત્મસ્વભાવં પરભાવભિન્માપૂર્ણમાદ્યન્તવિમુક્તમેકમ્ । વિલીનસંકલ્પવિકલ્પજાલં પ્રકાશયન् શુદ્ધનયોર્ભુદેતિ ॥૧૦॥
(માલિની)	ન હિ વિદધતિ બદ્ધસ્પૃષ્ટભાવાદયોર્મી સ્ફુટમુપરિ તરન્તોર્થેત્ય યત્ર પ્રતિષ્ઠામ્ । અનુભવતુ તમેવ દ્યોતમાનં સમન્તાત્ જગદપગતમોહીભૂય સમ્યક્સ્વભાવમ્ ॥૧૧॥

સમકિતરૂપ ગહૌ અપનોં ગુન,  
કરહુ સુદ્ધ અનુભવકૌ ખેલ ॥  
પુદ્ગલપિંડ ભાવ રાગાદિક,  
ઇનસૌં નહીં તુમ્હારૌ મેલ ।  
એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન,  
જૈસેં ભિન્ન તોય અસુ તેલ ॥૧૨॥

શાસ્ત્રાર્થ :- તોરણુ=તોડી નાખો. ગહૌ=ગ્રહણ કરો. ગુપત(ગુમ)=અરૂપી. તોય=પાણી.

અર્થ :- ભવ્ય જીવને શ્રીગુરુ ઉપદેશ કરે છે કે શીધ્ર મોહનું બંધન તોડી નાખો, પોતાનો સમ્યકૃત ગુણ ગ્રહણ કરો અને શુદ્ધ અનુભવમાં મસ્ત થઈ જાવ. પુદ્ગલ દ્રવ્ય અને રાગાદિક ભાવો સાથે તમારે કોઈ સંબંધ નથી. એ સ્પષ્ટ અચેતન છે અને તમે અરૂપી યૈતન્ય છો તથા પાણીથી બિન્ન તેલની પેઠે તેમનાથી જુદા છો. ૧૨.

સમ્યગદાસ્તિના વિલાસનું વર્ણન (સવૈયા એકત્રીસા)

કોઊ બુદ્ધિવંત નર નિરખે સરીર-ઘર,  
ભેદગ્નાનદૃષ્ટિસૌં વિચારૈ વસ્તુ-વાસતૌ ।  
અતીત અનાગત વરતમાન મોહરસ,  
ભીગ્યૌ ચિદાનંદ લખૈ બંધમૈ વિલાસતૌ ॥  
બંધકૌ વિદારિ મહા મોહકૌ સુભાઉ ડારિ,  
આત્માકૌ ધ્યાન કરૈ દેખૈ પરગાસતૌ ।

ભૂતં ભાન્તમભૂતમેવ રભસાનિર્ભિદ્ય બન્ધં સુધી-  
ર્યદ્યન્તઃ કિલ કોઽયહો કલયતિ વ્યાહત્ય મોહં હઠત् ।  
આત્માત્માનુભવૈકગયમહિમા વ્યક્તો�યમાસ્તે ધ્રુવં  
નિત્યં કર્મકલંકપંકવિકલો દેવઃ સ્વયં શાશ્વતઃ ॥૧૨॥

કરમ-કલંક-પંકરહિત      પ્રગટરૂપ,  
અચલ અબાધિત વિલોકે દેવ સાસતૌ ॥૧૩॥

શાસ્ત્રાર્થ : વિદારિ=નાન્દ કરીને. પંક=કીચડ. ભેદજ્ઞાન=આત્માને શરીર આટિથી ભિન્ન જાણવો.

અર્થ :—કોઈ વિદ્બાન મનુષ્ય શરીરરૂપી ઘરને જુએ અને ભેદજ્ઞાનની દાખિથી શરીરરૂપી ઘરમાં રહેનાર આત્મવસ્તુનો વિચાર કરે તો પહેલાં ભૂત, વર્તમાન, ભવિષ્ય એ ત્રણો કાળે મોહથી રંજિત અને કર્મબંધમાં કીડા કરતા આત્માનો નિશ્ચય કરે, ત્યાર પછી મોહના બંધનનો નાશ કરે અને મોહી સ્વભાવ છોડીને આત્મધ્યાનમાં અનુભવનો પ્રકાશ કરે, તથા કર્મકલંકના કાદવથી રહિત અચળ, અબાધિત, શાશ્વત પોતાના આત્મદેવને પ્રત્યક્ષ દેખે. ૧૩.

ગુણ-ગુણી અભેદ છે, એ વિચારવાનો ઉપદેશ કરે છે. (સવૈયા તેવીસા)

સુદ્ધનયાતમ      આત્મકી,  
અનુભૂતિ વિજ્ઞાન-વિભૂતિ હૈ સોઈ ।  
  
વસ્તુવિચારત      એક પદારથ,  
નામકે ભેદ કહાવત દોઈ ॥  
યૌં સરવંગ સદા લખિ આપુહિ,  
આત્મ-ધ્યાન કરે જब કોઈ ।  
  
મેટિ અસુદ્ધ વિભાવદસા તબ,  
સુદ્ધ સરૂપકી પ્રાપત્તિ હોઈ ॥૧૪॥

શાસ્ત્રાર્થ :— વિભાવ=પરવસ્તુના સંયોગથી જે વિકાર થાય તે. વિભૂતિ=સંપત્તિ.

અર્થ :—શુદ્ધનયના વિષયભૂત આત્માનો અનુભવ જ જ્ઞાનસંપદા છે, આત્મા

આત્માનુભૂતિરિતિ શુદ્ધનયાત્મિકા યા  
જ્ઞાનાનુભૂતિરિયમેવ કિલેતિ બુદ્ધવા ।  
આત્માનમાત્મનિ નિવેશ્ય સુનિષ્ઠકમ્-  
મેકોડસ્તિ નિત્યમવબોધઘનઃ સમન્તાત ॥૧૩॥

અને જ્ઞાનમાં નામભેદ છે, વસ્તુભેદ નથી, આત્મા ગુણી છે, જ્ઞાન ગુણ છે, તેથી ગુણી અને ગુણને ઓળખીને જ્યારે કોઈ આત્મધ્યાન કરે છે ત્યારે રાગાદિ અશુદ્ધ અવસ્થા નાશ પામીને શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે.

**ભાવાર્થ :**—આત્મા ગુણી છે અને જ્ઞાન તેનો ગુણ છે, એમનામાં વસ્તુભેદ નથી. જેમ અગ્નિનો ગુણ ઉષ્ણતા છે, જો કોઈ અગ્નિ અને ઉષ્ણતાને ભિન્ન પાડવા ઈચ્છે તો તે ભિન્ન થઈ શકતા નથી, તેવી જ રીતે જ્ઞાન અને આત્માનો સહભાવી સંબંધ છે પણ નામભેદ જરૂર છે કે આ ગુણી છે અને આ તેનો ગુણ છે. ૧૪.

જ્ઞાનીઓનું ચિંતન (સવૈયા એકત્રીસા)

અપનૈહી ગુન પરજાયસૌં પ્રવાહરૂપ,  
પરિનયૌ તિહું કાલ અપનૈ અધારસૌં ।  
  
અન્તર-બાહર-પરકાસવાન એકરસ,  
ખિન્તતા ન ગહૈ ભિન્ન રહૈ ભૌ-વિકારસૌં ॥  
  
ચેતનાકે રસ સરવંગ ભરિ રહ્યૌ જીવ,  
જૈસે લૌન-કાંકર ભરયૌ હે રસ ખારસૌં ।  
  
પૂરન-સુરૂપ અતિ ઊજલ વિગ્યાનઘન,  
મોક્ષો હોહુ પ્રગટ વિસેસ નિરવારસૌં ॥૧૫॥

**શાસ્ત્રાર્થ** :—ભિન્નતા=ન્યૂનતા. ભૌ(ભવ)=સંસાર. લૈન કંકર=મીઠાની કણી. નિરવારસૌં=ક્ષયથી.

**અર્થ** :—જીવ પદાર્થ સદૈવ પોતાના જ આધારે રહે છે અને પોતાના જ ધારા-પ્રવાહ ગુણ-પર્યાયોમાં પરિણામન કરે છે, બાધ્ય અને અભ્યંતર એકરસખો પ્રકાશિત રહે છે, કદ્દી ઘટતો નથી, તે સંસારના વિકારોથી ભિન્ન છે, તેમાં ચૈતન્યરસ એવો ઠાંસોઠાંસ

અખણ્ડિતમનાકુલં જ્વલદનન્તમન્તર્વહિ-  
રહઃ પરમપસ્તુ નઃ સહજપુદ્દિલાસં સદા ।  
ચિદુચ્છલનનિર્ભરં સકલકાલમાલમ્બતે  
યદેકરસમુલ્લાસલ્લવણખિલ્યલીલાયિતમ् ॥૧૪॥

ભર્યો છે જેવી રીતે મીઠાની ગાંગડી ખારાશથી ભરપૂર હોય છે. આવો પરિપૂર્ણ સ્વરૂપ, અત્યંત નિર્વિકાર, વિજ્ઞાનઘન આત્મા મોહના અત્યંત ક્ષયથી મને પ્રગટ થાવ. ૧૫.

સાધ્ય-સાધકનું સ્વરૂપ અથવા દ્રવ્ય અને ગુણ-પર્યાયોની અભેદ વિવક્ષા. (કવિત)

જંહ ધ્રુવર્ધર્મ કર્મછ્ય લચ્છન,  
સિદ્ધિ સમાધિ સાધિપદ સોઈ।  
સુદ્ધપયોગ જોગ મહિમંડિત  
સાધક તાહિ કહૈ સબ કોઈ॥  
યોં પરતચ્છ પરોચ્છ રૂપસૌં,  
સાધક સાધિ અવસ્થા દોઈ।  
દુહુકૌ એક ગ્યાન સંચય કરિ  
સેવૈ સિવવંછક થિર હોઈ॥૧૬॥

**શાલાય્ય :-** ધ્રુવર્ધર્મ=અવિનાશી સ્વભાવ. સાધ્ય=જે ઈષ્ટ, અભાધિત અને અસિદ્ધિ હોય.  
સુદ્ધપયોગ=વતરાગ પરિણાતિ. સિવવંછક=મોક્ષનો અભિલાષી. થિર=સ્થિર.

**અર્થ :-**—સર્વ કર્મ-સમૂહથી રહિત અને અવિનાશી સ્વભાવ સહિત સિદ્ધપદ સાધ્ય છે અને મન, વચન, કાયના યોગો સહિત શુદ્ધપયોગરૂપ અવસ્થા સાધક છે. તેમાં એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ છે, આ બંને અવસ્થાઓ એક જીવની છે, એમ જે ગ્રહણ કરે છે તે જ મોક્ષનો અભિલાષી સ્થિર-ચિત્ત થાય છે.

**ભાવાર્થ :-**—સિદ્ધ અવસ્થા સાધ્ય છે અને અરહંત, સાધુ, શ્રાવક, સમ્યકૃત્વી આદિ અવસ્થાઓ<sup>૧</sup> સાધક છે, એમાં પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ છે. આ બધી અવસ્થાઓ એક જીવની છે એમ જીણાર જ સમ્યગદિષ્ટ હોય છે. ૧૬.

૧. પૂર્વ અવસ્થા સાધક અને ઉત્તર અવસ્થા સાધ્ય હોય છે.

એ જ્ઞાનઘનો નિત્યમાત્મા સિદ્ધિમભીસુભિ: ।  
સાધ્યસાધકભાવેન દ્વિધૈક: સમુપાસ્યતામ् ॥૧૫॥

દ્રવ્ય અને ગુણ-પર્યાયોની ભેદ-વિવક્ષા (કવિત)

દરસન-ગ્યાન-ચરન ત્રિગુનાગમ,  
સમલરૂપ કહિયે વિવહાર ।  
નિહચૈ-દૃષ્ટિ એકરસ ચેતન,  
ભેદરહિત અવિચલ અવિકાર ।  
સમ્યકદસા પ્રમાન ઉભૈ નય,  
નિર્મલ સમલ એક હી બાર ।  
યૌં સમકાલ જીવ કી પરિનતિ,  
કહેં જિનેંદ ગહૈ ગનધાર ॥૧૭॥

**શાખાર્થ :-** સમલ=અહીં સમલ શબ્દથી અસત્યાર્થ, અભૂતાર્થનું પ્રયોજન છે. નિર્મલ=આ શબ્દથી અહીં સત્યાર્થ, ભૂતાર્થનું પ્રયોજન છે. ઉભૈ નય=બન્ને નય (નિશ્ચયનય અને વ્યવહારનય). ગનધાર=ગણધર (સમવસરણના પ્રધાન આચાર્ય).

**અર્થ :-** વ્યવહારનયથી આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર—એ ત્રણ ગુણરૂપ છે, આ વ્યવહારનય નિશ્ચયનયની અપેક્ષાએ અભૂતાર્થ છે, નિશ્ચયનયથી આત્મા એક ચૈતન્યરસસંપત્તિ, અભેદ, નિત્ય અને નિર્વિકાર છે. આ બન્ને નિશ્ચય અને વ્યવહારનય સમ્યગદૃષ્ટિને એક જ કાળમાં પ્રમાણ છે, એવી એક જ સમયમાં જીવની નિર્મણ અને સમણ પરિણાતિ જિનરાજે કહી છે અને ગણધરસ્વામીએ ધારણ કરી છે. ૧૭.

વ્યવહારનયથી જીવનું સ્વરૂપ (દોહરા)

એકરૂપ આત્મ દરબ, ગ્યાન ચરન દૃગ તીન ।  
ભેદભાવ પરિનામસૌં, વિવહારૈ સુ મલીન ॥૧૮॥

દર્શનજ્ઞાનચારિત્રૈસ્ત્રિત્વાદેકત્વતઃ સ્વયમ् ।  
મેચકોऽમેચકશાપિ સમમાત્મા પ્રમાણતઃ ॥૧૬॥  
દર્શનજ્ઞાનચારિત્રૈસ્ત્રિભિઃ પરિણતત્વતઃ ।  
એકોऽપિ ત્રિસ્વભાવત્વાદ્યવહારેણ મેચકઃ ॥૧૭॥

**અર્થ :**—આત્મદ્રવ્ય એકરૂપ છે, તેને દર્શન, શાન, ચારિત્ર-ત્રણ ભેદરૂપ કહેવું તે વ્યવહાર નય છે-અસત્યાર્થ છે. ૧૮.

નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ (દોહરા)

જદાપિ સમલ વિવહારસૌં, પર્યયસકતિ અનેક।  
તદાપિ નિયત-નય દેખિયે, શુદ્ધ નિરંજન એક॥૧૯॥

**શાસ્ત્રાર્થ :**— નિયત=નિશ્ચય. નિરંજન=કર્મમળ રહિત.

**અર્થ :**—જો કે વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અનેક ગુણ અને પર્યાપ્તવાળો છે તો પણ નિશ્ચયનયથી જોવામાં આવે તો એક, શુદ્ધ નિરંજન જ છે. ૧૮.

શુદ્ધ નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ (દોહરા)

એક દેખિયે જાનિયે, રમી રહિયે ઇક ઠૌર।  
સમલ વિમલ ન વિચારિયે, યહે સિદ્ધિ નહિ ઔર॥૨૦॥

**શાસ્ત્રાર્થ :**— રમી રહિયે=વિશ્રામ લેવો. ઈક ઠૌર=એક સ્થાન.

**અર્થ :**—આત્માને એકરૂપ શ્રદ્ધવો અથવા એકરૂપ જ જાણવો જોઈએ તથા એકમાં જ વિશ્રામ લેવો જોઈએ, નિર્મળ-સમળનો વિકલ્પ ન કરવો જોઈએ. એમાં જ સર્વસિદ્ધિ છે, બીજો ઉપાય નથી.

**ભાવાર્થ :**—આત્માને નિર્મળ-સમળના વિકલ્પ રહિત એકરૂપ શ્રદ્ધવો તે સમ્યગ્દર્શન છે, એકરૂપ જાણવો તે સમ્યક્ષજ્ઞાન છે અને એકરૂપમાં જ સ્થિર રહેવું તે સમ્યક્ષચારિત્ર છે, એ જ મોક્ષનો ઉપાય છે. ૨૦.

૧. દોહરા — જેતે ભેદ વિકલ્પ હોય, તે તે સબ વિવહાર,  
નિરાબાધ નિરકલ્પ સો, નિશ્ચય નય નિરધાર.

પરમાર્થન તુ વ્યક્તજ્ઞાતૃત્વજ્યોતિષૈકકઃ ।  
સર્વભાવાન્તરધ્યંસિસ્વભાવત્વાદમેચકઃ ॥૧૯૮॥  
આત્મનશ્રિન્તયૈવાલં મેચકામેચકત્વયોः ।  
દર્શનજ્ઞાનચારિત્રૈ: સાધ્યસિદ્ધિર્ન ચાન્યથા ॥૧૯૯॥

શુભ અનુભવની પ્રશંસા (સવૈયા એકત્રીસા)

જાકે પદ સોહત સુલચ્છન અનંત ગ્યાન  
વિમલ વિકાસવંત જ્યોતિ લહલહી હૈ।  
યદ્યપિ ત્રિવિધરૂપ વિવહારમે તથાપિ  
એકતા ન તજે યૌ નિયત અંગ કહી હૈ॥  
સો હૈ જીવ કેસીહૂં જુગતિકૈ સદીવ તાકે,  
ધ્યાન કરિબેકોં મેરી મનસા ઉનહી હૈ।  
જાતે અવિચલ રિદ્ધિ હોત ઔર ભાંતિ સિદ્ધિ,  
નાહીં નાહીં યામેં ધોખો નાહીં સહી હૈ॥૨૧॥

**શાલાર્થ :-** જુગતિ=યુક્તિ, મનસા=અભિલાષા. ઉનહી હૈ=તૈયાર થઈ છે. અવિચલ રિદ્ધિ=ભોક્ષ. ધોખો=સંદેહ.

**અર્થ :-** આત્મા અનંત જ્ઞાનરૂપ લક્ષણથી લક્ષિત છે, તેના જ્ઞાનની નિર્મળ પ્રકાશવાળી જ્યોતિ જગી રહી છે. જો કે તે વ્યવહારનયથી ત્રણરૂપે<sup>૧</sup> છે તો પણ નિશ્ચયનયથી એક જ રૂપ છે, તેનું કોઈ પણ યુક્તિથી સદા ધ્યાન કરવાને મારું ચિત્ત ઉત્સાહી બન્યું છે, એનાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે અને કોઈ બીજો ઉપાય કાર્ય સિદ્ધ થવાનો નથી! નથી!! નથી!!! એમાં શંકા કોઈ શંકા નથી, બિલકુલ સત્ય છે. ૨૧.

જ્ઞાતાની અવર્થા (સવૈયા એકત્રીસા)

કૈ અપનોં પદ આપ સંભારત,  
કૈ ગુરુકે મુખકી સુનિ બાની।

૧. દર્શન, જ્ઞાન, ચારિત્ર. ૨. અહીં વારંવાર ‘નથી’ એમ કહીને કથનનું સમર્થન કર્યું છે.

કથમપિ સમુપાત્તન્ત્રિત્વમષેકતાયા  
અપતિતમિદમાત્મજ્યોતિરુદ્ધચ્છદ્ધમ् ।  
સતતમનુભવામોઽનત્ત્વચૈતન્યચિહ્નं  
ન ખલુ ન ખલુ યસ્માદન્યથા સાધ્યસિદ્ધઃ ॥૨૦॥

ભેદવિજ્ઞાન જગ્યો જિન્હિકૈ,  
પ્રગટી સુવિવેક-કલા-રસધાની ॥  
ભાવ અનંત ભએ પ્રતિબિંબિત,  
જીવન મોહ દસા ઠહરાની ।  
તે નર દર્પન જ્યો અવિકાર,  
રહેં થિરરૂપ સદા સુખદાની ॥૨૨॥

શાસ્ત્રાર્થ :— રસધાની=શક્તિ. જીવને મોખ દર્શા=જાણે અહીં જ મોક્ષ પ્રાપ્ત કરી ચૂક્યા.

અર્થ :—પોતાની જાતે પોતાનું સ્વરૂપ સાંભળવાથી<sup>૧</sup> અથવા શ્રીગુરુના મુખારવિંદ દ્વારા ઉપદેશ સાંભળવાથી<sup>૨</sup> જેમને ભેદજ્ઞાન જગ્યાત થયું છે અર્થાત્ સ્વપર વિવેકની જ્ઞાનશક્તિ પ્રગટ થઈ છે, તે મહાત્માઓને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. તેમના નિર્મણ દર્પણ જેવા સ્વર્ચ આત્મામાં અનંત ભાવ જણકે છે પરંતુ તેનાથી કાંઈ વિકાર થતો નથી. તેઓ સદા આનંદમાં ભસ્તા રહે છે. ૨૨.

ભેદજ્ઞાનનો મહિમા (સવૈયા એકત્રીસા)

યાહી વર્તમાનસમૈ ભવ્યનિકૌ મિટૌ મૌહ,  
લગ્યૌ હૈ અનાદિકૌ પગ્યૌ હૈ કર્મમલસૌં ।  
ઉદૈ કરૈ ભેદજ્ઞાન મહા રુચિકૌ નિધાન,  
ઉરકૌ ઉજારૌ ભારૌ ન્યારૌ દુંદ-દલસૌં ॥

૧. આ નેસર્જિક સમ્બ્રદ્ધન છે. ૨. આ અધિગમજ સમ્બ્રદ્ધન છે.

કથમણિ હિ લભન્તે ભેદવિજ્ઞાનમૂલામચલિતમનુભૂતિં યે સ્વતો વાન્યતો વા ।  
પ્રતિફલનનિમગ્નાનન્તભાવસ્વભાવૈમુકુરવદવિકારાઃ સન્તતં સ્યુસ્ત એવ ॥૨૧॥

ત્વજતુ જગદિદારો મોહમાજન્મલીં  
રસયતુ રસિકાનાં રોચનાં જ્ઞાનમુધ્યત્ ।  
ઇહ કથમણિ નાત્માનાત્મના સાકમેક:  
કિલ કલયતિ કાલે કવાપિ તાદાત્મ્યવૃત્તિમ् ॥૨૨॥

જાતેં થિર રહૈ અનુભૌ વિલાસ ગહૈ ફિરિ,  
કબહૂ અપનપૌ ન કહૈ પુદગલસૌં ।  
યહૈ કરતૂતિ યૌં જુદાઈ કરૈં જગતસૌં,  
પાવક જ્યોં ભિન્ન કરૈ કંચન ઉપલસૌં ॥૨૩॥

**શાલાર્થ :-** નિધાન=ખજાનો. દુંદ(દુંદ)=સંશય. ઉપલ=પત્થર. મહારુચિ=દેહ શ્રદ્ધાન  
જગત=જન્મ-મરણરૂપ સંસાર.

**અર્થ :-**—આ સમયે જ ભવ્ય જીવોનો અનાદિકાળથી લાગેલો અને કર્મમળથી મળેલો મોહ નાથ થઈ જાવ. એ નાથ થઈ જવાથી હૃદયમાં મહાપ્રકાશ કરનાર, સંશય-સમૂહને મટાડનાર, દેહ શ્રદ્ધાનની રૂચિ-સ્વરૂપ બેદ-વિજ્ઞાન પ્રગટ થાય છે. એનાથી સ્વરૂપમાં વિશ્રાબ અને અનુભવનો આનંદ મળે છે તથા શરીરાદિ પુદ્ગલ પદાર્થોમાં કદી અહંબુદ્ધિ રહેતી નથી. આ કિયા તેમને સંસારથી એવી રીતે ભિન્ન કરી નાખે છે જેમ અજિનિ સુવર્ણને કિદિકા (પત્થર)થી ભિન્ન કરી દે છે. ૨૩.

પરમાર્થની શિક્ષા (સવૈયા એકત્રીસા)

બાનારસી કહૈ ભૈયા ભવ્ય સુનૌ મેરી સીખ,  
કૈહું ભાંતિ કૈસૈહુંકે એસૌ કાજુ કીજિએ ।  
એકહૂ મુહૂરત મિથ્યાતકૌ વિધુંસ હોઇ,  
ગ્યાનકૌં જગાઇ અંસ હંસ ખોજિ લીજિએ ।  
વાહીકૌ વિચાર વાકૌ ધ્યાન યહૈ કૌતુહલ,  
યૌં હી ભરિ જનમ પર રસ પીજિએ ।

અયિ કથમપિ મૃત્વા તત્ત્વકૌતૂહલી સન્  
અનુભવ ભવ મૂર્તિ: પાર્થવર્તી મુહૂર્તમ् ।  
પૃથગથ વિલસન્તં સ્વં સમાલોક્ય યેન  
ત્યજસિ ઝાગિતિ મૂર્યા સાકમેકત્વમોહમ् ॥૨૩॥

## તજિ ભવ-વાસકૌ વિલાસ સવિકારરૂપ, અંતકરિ મૌહકૌ અનંતકાલ જીજિએ ॥૨૪॥

**શાન્દાર્ય** :- કેહું ભાંતિ=કોઈપણ ઉપાયથી. કેસેં હૂકે=પોતે કોઈ પ્રકારનો બનીને. હંસ=આત્મા. ક્રોતૂહલ=કૃડા. ભવવાસકો વિલાસ=જન્મ-મરણમાં ભટકવું. અનંતકાળ જીજિએ=અમર થઈ જાવન અર્થાત્ સિદ્ધપદ પ્રાપ્ત કરો.

**અર્થ** :- પં. બનારસીદાસજી કહે છે—હે ભાઈ ભવ્ય! મારો ઉપદેશ સાંભળો કે કોઈ પણ ઉપાયથી અને કોઈ પણ પ્રકારનો બનીને એવું કામ કર જેથી માત્ર અંતમુહૂર્તને<sup>૧</sup> માટે મિથ્યાત્વનો ઉદ્ય ન રહે, જ્ઞાનનો અંશ જાગ્રત થાય, આત્મસ્તવરૂપની ઓળખાણ થાય, જિંદગીભર તેનો જ વિચાર, તેનું જ ધ્યાન, તેની જ લીલામાં પરમરસનું પાન કરો અને રાગ-દ્વેષમય સંસારનું પરિભ્રમણ છોડીને તથા મોહનો નાશ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરો. ૨૪.

તીર્થકર ભગવાનના શરીરની સ્તુતિ (સવૈયા એકત્રીસા)

જાકે દેહ-દ્યુતિસૌં દસૌં દિસા પવિત્ર ભર્દી,  
જાકે તેજ આગેં સબ તેજવંત રુકે હૈં।  
જાકૌ રૂપ નિરખિ થકિત મહા રૂપવંત,  
જાકી વપુ-વાસસૌં સુવાસ ઔર લુકે હૈં ॥  
જાકી દિવ્યધુનિ સુનિ શ્રવણકૌં સુખ હોત,  
જાકે તન લચ્છન અનેક આઇ ઢુકે હૈં।

૧. બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટમાં એક સમય ઓછો

કાન્ત્યૈવ સ્નપયન્તિ યે દશદિશો ધામા નિરુદ્ધન્તિ યે  
ધામોદામમહસિનાં જનમનો મુણ્ણન્તિ સ્યેણ યે ।  
દિવ્યેન ધ્વનિના સુખં શ્રવણયો: સાક્ષાત્કારન્તોમૃતં  
વન્દ્યાસ્તેષસહસ્રલક્ષણધરાસ્તીર્થશ્રા: સૂર્યઃ ॥૨૪॥

તેઈ જિનરાજ જાકે કહે વિવહાર ગુન,  
નિહચૈ નિરખિ સુદ્ધ ચેતનસૌં ચુકે હૈને॥૨૫॥

**શાસ્ત્રાર્થ :-**—વપુ-વાસસૌં=શરીરની ગંધશી. લુકે=છુપાઈ ગયા. હુકે=પ્રવેશ કર્યો. ચુકે=જુદા.

**અર્થ :-**—જેમના શરીરની આભા (તેજ)થી દશે દિશાઓ પવિત્ર થાય છે, જેના તેજ આગળ બધા તેજવાળાઓ<sup>૧</sup> લજીજત થાય છે, જેમનું રૂપ જોઈને મહારૂપવાન<sup>૨</sup> હાર માને છે. જેમના શરીરની સુગંધ<sup>૩</sup> પાસે બધી સુગંધ છુપાઈ જાય છે, જેમની દિવ્યવાણી સાંભળવાથી કાનોને સુખ થાય છે, જેમના શરીરમાં અનેક શુભ લક્ષણો<sup>૪</sup> આવી વસ્યાં છે; એવા તીર્થકર ભગવાન છે. તેમના આ ગુણો વ્યવહારનયથી કહ્યા છે, નિશ્ચયનયથી જુઓ તો શુદ્ધ આત્માના ગુણોથી આ દેહાશ્રિત ગુણો ભિન્ન છે. ૨૫.

જામૈં બાલપનૌ તરુનાપૌ વૃદ્ધપનૌ નાહિં,  
આયુ-પરજંત મહારૂપ મહાબલ હૈ।

બિના હી જતન જાકે તનમૈં અનેક ગુન,  
અતિસૈ-વિરાજમાન કાયા નિર્મલ હૈ॥

જૈસેં વિનુ પવન સમુદ્ર અવિચલરૂપ,  
તૈસૈં જાકોં મન અરુ આસન અચલ હૈ।

એસૌ જિનરાજ જયવંત હોઉ જગતમૈં,  
જાકી સુભગતિ મહા સુકૃતકૌ ફલ હૈ॥૨૬॥

**શાસ્ત્રાર્થ :-**—તરુનાપૌ=યુવાની. કાયા=શરીર. અવિચળ=સ્થિર. સુભગતિ=શુભભક્તિ.

- |   |                         |
|---|-------------------------|
| ૧. સૂર્ય, ચંદ્રમા વગેરે.                                    | ૨. ઈન્દ્ર, કામદેવ વગેરે |
| ૩. મંદાર, સુપારિજીત વગેરે ફૂલોની.                           |                         |
| ૪. કમળ, ચક, ધજા, કલ્પવૃક્ષ, સિંહાસન, સમુદ્ર આદિ ૧૦૦૮ લક્ષણ. |                         |

પ્રાકારકવલિતામ્બરમુપવનરાજીનિગીર્ણભૂમિતલમ् ।  
પિબતીવ હિ નગરમિદં પરિખાવલયેન પાતાલમ् ॥૨૫॥

**અર્થ :**—જેમને બાળ, તરુણ અને વૃદ્ધપણું<sup>૧</sup> નથી, જેમને જીવનભર અત્યંત સુંદર રૂપ અને અતુલ બળ રહે છે, જેમના શરીરમાં સ્વતઃ સ્વભાવથી જ અનેક ગુણો અને અતિશયો<sup>૨</sup> બિરાજે છે તથા શરીર અત્યંત ઉજ્જવળ<sup>૩</sup> છે, જેમનું મન અને આસન પવનની લહેરોથી રહિત સમુદ્ર સમાન સ્થિર છે, તે તીર્થકર ભગવાન સંસારમાં જ્યવંત હો, જેમની શુભભક્તિ ઘણા મોટા પુષ્યના ઉદ્યે પ્રામ થાય છે. ૨૬.

જીનરાજનું યથાર્થ સ્વરૂપ (દોહરા)

જિનપદ નાંહિ શરીરકૌ, જિનપદ ચેતનમાંહિ।  
જિનવર્નન કષુ ઔર હૈ, યહ જિનવર્નન નાંહિ॥૨૭॥

**શાસ્ત્રાર્થ :-** ઓર=બિજું. જિન=જિતે તે જિન અર્થાત् જેમણે કામ-કોધાદિ શત્રુઓને જત્યા છે.

**અર્થ :-**—આ(ઉપર કહેલું) જિન-વર્ણન નથી, જિન-વર્ણન એનાથી ભિન્ન છે; કારણ કે જિનપદ શરીરમાં નથી, ચેતનાર ચેતનમાં છે. ૨૭

પુદ્ગાલ અને ચૈતન્યના ભિન્ન સ્વભાવ ઉપર દષ્ટાંત (સવૈયા એકબ્રીસા)

ऊँચે ઊંચે ગઢકે કંગૂરે યોં વિરાજત હૈન,  
માનોં નભલોક ગીલિવેકોં દાંત દીયો હૈ।  
સોહૈ ચહું ઓર ઉપવનકી સઘનતાઈ,  
ઘેરા કરિ માનૌ ભૂમિલોક ઘેરિ લીયો હૈ॥  
ગહિરી ગંભીર ખાઈ તાકી ઉપમા બનાઈ,  
નીચો કરિ આનન પતાલ જલ પીયો હૈ।

૧. બાળકની પેઠે અજ્ઞાનપણું, યુવાનની પેઠે મદાન્ધપણું અને વૃદ્ધની પેઠે દેહનું જીર્ણપણું હોતું નથી.

૨. ચોત્રીસ અતિશય ઊ. પરસેવો, નાક, કાન આદિ મળરહિત છે.

નિત્યમવિકારસુસ્થિતસર્વાગમપૂર્વસહજલાવણ્યમ् ।  
અક્ષોભમિવ સમુદ્ર જિનેન્દ્રરૂપં પરં જયતિ ॥૨૬॥

એસો હૈ નગર યામેં નૃપકૌ ન અંગ કોઊ,  
યાંહી ચિદાનંદસૌં સરીર ભિન્ન કીયૌ હૈ॥૨૮॥

શાલાર્થ : :- ગઠ=કિલ્લો. નભલોક=સ્વર્ગ. આનન=મોહું.

અર્થ :—જે નગરમાં મોટા મોટા ઊંચા કિલ્લા છે, જેના કાંગરા એવા શોભે છે જાણે કે સ્વર્ગને ગળી જવાને માટે દાંત જ ફેલાવ્યા છે, તે નગરની યારે તરફ સધન બગીચા એવા શોભી રહ્યા છે જાણે મધ્યલોકને જ ઘેરી લીધો છે અને તે નગરની એવી મોટી ઊંડી ખાઈઓ છે કે જાણે તેમણે નીચું મુખ કરીને પાતાળલોકનું જળ પી લીધું છે, પરંતુ તે નગરથી રાજા ભિન્ન જ છે તેવી જ રીતે શરીરથી આત્મા ભિન્ન છે.

ભાવાર્થ :—આત્માને શરીરથી સર્વથા ભિન્ન ગણવો જોઈએ. શરીરના કથનને આત્માનું કથન ન સમજવું. ૨૮.

તીર્થકરના નિશ્ચય સ્વરૂપની સ્તુતિ (સવૈયા એકશ્રીસા)

જામેં લોકાલોકકે સુભાવ પ્રતિભાસે સબ,  
જગી ગ્યાન સકતિ વિમલ જૈસી આરસી।  
દર્સન ઉદ્ઘોત લીયૌ અંતરાય અંત કીયૌ,  
ગયૌ મહા મોહ ભયૌ પરમ મહારસી ॥  
સંન્યાસી સહજ જોગી જોગસૌં ઉદાસી જામેં,  
પ્રકૃતિ પચાસી લગિ રહી જરિ છારસી।  
સોહૈ ઘટ મંદિરમૈં ચેતન પ્રગટરૂપ,  
એસૌ જિનરાજ તાહિ બંદત બનારસી ॥૨૯॥

શાલાર્થ :—પ્રતિભાસે=પ્રતિબિંબિત થાય છે. દર્શન=અહીં કેવળદર્શનનું પ્રયોજન છે.  
છારસી=રાખ સમાન.

અર્થ :—જેમને એવું જ્ઞાન જાગ્રત થયું છે કે જેમાં દર્પણાની પેઠે લોકાલોકના ભાવ પ્રતિબિંબિત થાય છે, જેમને કેવળદર્શન પ્રગટ થયું છે, જેમને અંતરાયકર્મ નાશ પામ્યું છે, જેમને મહામોહકર્મનો નાશ થવાથી પરમ સાધુ અથવા મહાસંન્યાસી

અવસ્થા પ્રામ થઈ છે, જેમણે સ્વાભાવિક યોગો ધારણ કર્યા છે તોપણ જે યોગોથી વિરક્ત છે, જેમને માત્ર પંચાસી<sup>+</sup> પ્રકૃતિઓ બણી ગયેલી સીંદ્રીની રાખની પેઢે લાગેલી છે, એવા તીર્થકરદેવ દેહરૂપ દેવાલયમાં સ્પષ્ટ ચૈતન્યમૂર્તિ શોભાયમાન થાય છે, તેમને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨૮.

નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ શરીર અને જિનવરનો ભેદ (કવિતા)

તન ચેતન વિવહાર એકસે,  
નિહચૈ ભિન્ન ભિન્ન હેં દોડી।  
તનકી થુતિ વિવહાર જીવથુતિ,  
નિયતદૃષ્ટિ મિથા થુતિ સોડી ॥

- + ૧—અશાતાવેદનીય, ૨—દેવગતિ, પાંચ શરીર—૩—ઔદારિક ૪—વૈકિયક, ૫—આહારક ૬—તૈજસ  
૭—કાર્મણ. પાંચ બંધન—૮—ઔદારિક, ૯—વૈકિયક, ૧૦—આહારક ૧૧—તૈજસ ૧૨—કાર્મણ. પાંચ  
સંધાત—૧૩—ઔદારિક, ૧૪—વૈકિયક, ૧૫—આહારક, ૧૬—તૈજસ, ૧૭—કાર્મણ. ઇ સંસ્થાન—  
૧૮—સમયતુરસ્થ સંસ્થાન ૧૯—ન્યોધપરિમંડલ ૨૦—સ્વાતિક ૨૧—બાવન ૨૨—કુદ્જક ૨૩—  
હુંડક. ત્રણ અંગોપાંગ—૨૪—ઔદારિક ૨૫—વૈકિયક ૨૬—આહારક. ઇ સંહનન—૨૭—  
વજ્ઝભનારાચ ૨૮—વજનારાચ ૨૯—નારાચ ૩૦—અર્ધનારાચ ૩૧—કીલક ૩૨—સ્ફાટિક પાંચ  
વર્ષા—૩૩—કાળો ૩૪—લીલો ૩૫—પીળો ૩૬—સફેદ ૩૭—લાલ. બે ગંધ ૩૮—સુગંધ ૩૯—દુર્ગંધ.  
પાંચ ૨૮—૪૦—તીખો ૪૧—ખાટો ૪૨—કડવો ૪૩—મીઠો ૪૪—કખાયેલો ૪૫—કોમળ ૪૬—કઠોર  
૪૭—દંડો ૪૮—ગરમ ૪૯—હલકો ૫૦—કખાયેલો ૫૧—સ્નિગ્ધ ૫૨—રૂક્ષ ૫૩—દેવગતિ  
પ્રાયોગ્યાનુપૂર્વ ૫૪—અગુરુલઘુ ૫૫—ઉપધાત ૫૬—પરધાત ૫૭—ઉચ્છ્વાસ ૫૮—પ્રશસ્ત  
વિહાયોગતિ ૫૯—અપ્રશસ્ત વિહાયોગતિ ૬૦—અપર્યામક ૬૧—પ્રત્યેક શરીર ૬૨—સિથર ૬૩—  
અસ્થિર ૬૪—શુભ ૬૫—અશુભ ૬૬—દુર્ભર્ગ ૬૭—સુસ્વર ૬૮—દુસ્વર ૬૯—અનાદેય ૭૦—  
અયઃક્રીતિ ૭૧—નિર્મણ ૭૨—નીચગોત્ર ૭૩—શાતા વેદનીય ૭૪—મનુષ્યગતિ ૭૫—મનુષ્યાયુ  
૭૬—પંચેન્દ્રિય જાતિ ૭૭—મનુષ્યગતિ પ્રાયોગ્યાનુપૂર્વ ૭૮—ત્રસ ૭૯—બાદર, ૮૦—પર્યામક ૮૧—  
સુભ ૮૨—આદેય ૮૩—યશ:ક્રીતિ ૮૪—તીર્થકર ૮૫—ઉચ્ચ ગોત્ર.

એકત્વं વ્યવહારતો ન તુ પુનઃ કાયાત્મનોર્નિશ્વયાત्-  
નુ: સ્તોત્રં વ્યવહારતોર્સ્તિ વપુષ: સ્તુત્યા ન તત્ત્વતત: ।  
સ્તોત્રં નિશ્ચયતશ્ચિતો ભવતિ ચિત્સુત્યૈવ સૈવં ભવે-  
નાતસ્તીર્થકરસ્તવોત્તરબલાદેકત્વમાત્માઙ્ગ્યો: ॥૨૭॥

જિન સો જીવ જીવ સો જિનવર,  
તન જિન એક ન માનૈ કોઈ।  
તા કારન તનકી સંસુતિસૌં,  
જિનવરકી સંસુતિ નહિ હોડે ॥૩૦॥

**અર્થ :**—વ્યવહારનયમાં શરીર અને આત્માની એકતા છે, પરંતુ નિશ્ચયનયમાં બસે જુદા-જુદા છે. વ્યવહારનયમાં શરીરની સ્તુતિને જીવની સ્તુતિ ગણવામાં આવે છે પરંતુ નિશ્ચયનયની દષ્ટિથી તે સ્તુતિ ભિથ્યા છે. નિશ્ચયનયમાં જે જિનરાજ છે તે જીવ છે અને જે જીવ છે તે જે જિનરાજ છે. આ નય શરીર અને આત્માને એક નથી માનતો એ કારણે નિશ્ચયનયથી શરીરની સ્તુતિ તે જિનરાજની સ્તુતિ થઈ શકતી નથી. ૩૦.

વસ્તુસ્વરૂપની પ્રાભિમાં ગૃહ્ણલક્ષ્મીનું દષ્ટાંત (સરૈયા એકત્રીસા)

જ્યૌં ચિરકાલ ગડી વસુધામહિ,  
ભૂરિ મહાનિધિ અંતર ગૂઝી।  
કોઉ ઉખારિ ધૌર મહા ઊપરિ,  
જે દૃગવંત તિન્હેં સબ સૂઝી ॥૩૧॥.  
ત્યૌં યહ આત્મકી અનુભૂતિ;  
પડી જડ્ભાઉ અનાદિ અરૂઢી।  
ને જુગતાગમ સાધિ કહી ગુરુ,  
લચ્છન-વેદિ વિચ્છન બૂઝી ॥૩૧॥

**શાસ્ત્રાર્થ :-** ભૂરિ=ધણી. ગૂઝી=ધૂપાયેલી. ભહિ=પૃથ્વી. અરૂઝી=ગુંચવાયેલી. વિચ્છન

ઇતિ પરિચિતતત્ત્વૈરાત્મકાયैકતાયાં  
નયવિભજનયુક્ત્યાત્યન્તમુચ્છાદિતાયામ् ।  
અવતરતિ ન બોધો બોધમેવાદ્ય કસ્ય  
સ્વરસરભસકૃષ્ટ: પ્રસ્કૃટન્નેક એવ ॥૨૮॥

(વિચક્ષણ)=યતુર. લચ્છનવેદિ=લક્ષ્મણોના જાણનાર, બૂજી=સમજ્યા.

**અર્થ :**—જેવી રીતે ઘણા સમયથી પૃથ્વીની અંદર દટાયેલ ઘનને ખોઢીને કોઈ બહાર મૂકી દે તો દસ્તિવાળાઓને તે બધું દેખાવા લાગે છે, તેવી જ રીતે અનાદિકાળથી અજ્ઞાનભાવમાં દખાયેલ આત્મજ્ઞાનની સંપત્તિને શ્રીગુરુએ નથી, યુક્તિ અને આગમથી સિદ્ધ કરીને સમજાવી છે, તેને વિદ્વાનો લક્ષ્મણ વડે ઓળખીને ગ્રહણ કરે છે.

**વિશેષ :**--આ છંદમાં ‘દૃગવંત’ પદ આપ્યું છે, તે જેવી રીતે બહાર કાઢેલું ધન પણ આંખોવાળાને જ દેખાય છે—આંધળાઓને નથી દેખાતું તેવી જ રીતે શ્રીગુરુ દ્વારા બતાવવામાં આવેલું તત્ત્વજ્ઞાન અંતર્દસ્તિ ભવ્યોને પ્રામ થાય છે, દીર્ઘ સંસારી અને અભવ્યોની બુદ્ધિમાં નથી આવતું. ૩૧

ભેદવિજ્ઞાનની પ્રાસિમાં ધોબીના વણનું દષ્ટાંત (સવૈયા એકગ્રીસા)

જૈસેં કોऊ જન ગયૌ ધોબીકે સદન તિન,

પહિર્યૌ પરાયૌ વસ્ત્ર મેરૌ માનિ રહ્યૌ હૈ।

ધની દેખિ કહ્યૌ ભૈયા યહ તો હમારૌ વસ્ત્ર,

ચીન્હૈ પહિચાનત હી ત્યાગભાવ લહ્યૌ હૈ॥

તૈસેં હી અનાદિ પુદ્ગલસૌં સંજોગી જીવ,

સંગકે મમત્વસૌં વિભાવ તામૈં બહ્યૌ હૈ।

ભેદજ્ઞાન ભયૌ જબ આપૌ પર જાન્યૌ તબ

ન્યારૌ પરભાવસૌં સ્વભાવ નિજ ગહ્યૌ હૈ॥૩૨॥

**શાન્દાર્થ :-** સદન=ધર. વિભાવ=પરવસ્તુના સંયોગથી જે વિકાર થાય તે.

**અર્થ :**—જેમ કોઈ મનુષ્ય ધોબીના ધેર જાય અને બીજાનું કપડું પહેરીને પોતાનું માનવા લાગે, પરંતુ તે વસ્ત્રનો માલિક જોઈને કહે કે આ તો મારું કપડું છે, તો તે મનુષ્ય પોતાના વસ્ત્રનું ચિહ્ન જોઈને ત્યાગબુદ્ધિ કરે છે, તેવી જ રીતે આ કર્મસંયોગી

અવતરતિ ન યાવદ્વૃત્તિમત્વન્તવેગા દનવમપરભાવત્યાગદૃષ્ટાન્તદૃષ્ટિ: ।

જ્ઞાનિતિ સકલભાવૈરન્યદીયૈર્વિમુક્તા સ્વયમિયમનુભૂતિસ્તાવદાવિર્બંધુ ॥૨૯॥

જીવ પરિશ્રેહના મમત્વથી વિભાવમાં રહે છે અર્થાત् શરીર આદિને પોતાનું માને છે પરંતુ ભેદવિજ્ઞાન થતાં જ્યારે સ્વ-પરનો વિવેક થઈ જાય છે તો રાગાદિ ભાવોથી ભિન્ન પોતાના નિજ-સ્વભાવનું ગ્રહણ કરે છે. ઉ૨.

નિજાત્માનું સત્ય સ્વરૂપ (અડિલ છંદ)

કહૈ વિચછન પુરુષ સદા મૈં એક હોં।

અપને રસસૌં ભર્યૌ આપની ટેક હોં॥

મોહકર્મ મમ નાંહિ નાંહિ ભ્રમકૂપ હૈ।

સુદ્ધ ચેતના સિંધુ હમારૌ રૂપ હૈ॥૩૩॥

શાન્દાર્થ :— ટેક=આધાર. મમ=મારું. સિંધુ=સમુદ્ર.

અર્થ :—જ્ઞાની પુરુષ એવો વિચાર કરે છે કે હું સદૈવ એકલો છું. પોતાના જ્ઞાન-દર્શન રસથી ભરપૂર પોતાના જ આધારે છું, ભ્રમજીળનો કૂપ મોહકર્મ મારું સ્વરૂપ નથી! નથી!! મારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્યસિંધુ છે. ઉ૩.

તત્પજ્ઞાનથી થતા જીવની અવસ્થાનું વર્ણન (સવૈયા એકશ્રીસા)

તત્ત્વકી પ્રતીતિસૌં લખ્યૌ હૈ નિજપરગુન,

દૃગ જ્ઞાનચરન ત્રિવિધ પરિનયો હૈ।

વિસદ વિવેક આયૌ આછૌ વિસરામ પાયૌ,

આપુહીમૈં આપનૌ સહારૌ સોધિ લયૌ હૈ॥

કહત બનારસી ગહત પુરુષારથકૌ,

સહજ સુભાવસૌં વિભાવ મિટિ ગયૌ હૈ।

૧. અહીં બે વાર ‘નથી’ કહીને વિષયનું સમર્થન કર્યું છે.

સર્વતઃ સ્વરસનિર્ભરભાવં ચેતયે સ્વયમહં સ્વમિહૈક્મ ।

નાસ્તિ નાસ્તિ મમ કક્ષન મોહઃશુદ્ધચિદ્ધનમહોનિધિરસ્મ ॥૩૦॥

ઇતિ સતિ સહ સર્વેરન્યભાવૈવિવિકે સ્વયમયમુપયોગો વિભ્રદાત્માનમેકમ્ ।

પ્રકટિતપરમાર્થેર્દર્શનજ્ઞાનવૃત્તૈઃ કૃતપરિણતિરાત્મારામ એવ પ્રવૃત્તઃ ॥૩૧॥

પત્રાકે પકાયે જैસેં કંચન વિમલ હોત,  
તૈસેં સુદ્ધ ચેતન પ્રકાશરૂપ ભયો હૈ॥૩૪॥

**શાસ્ત્રાર્થ :-** પ્રતીતિ=શ્રદ્ધાન. વિશાદ=નિર્મળ. વિસરામ(વિશ્રામ)=યેન. સોધિ=ગોતીને. પત્રાકે પકાયે જૈસેં કંચન વિમલ હોત=અશુદ્ધ સોનાના નાના નાના ટુકડા કરીને કાગળ જેવા પાતળા બનાવે છે તેને પત્રા કહે છે. તે પત્રાઓને મીઠું, તેલ, વગેરે રસાયણથી અનિમાં પકવે છે તેથી સોનું અત્યંત શુદ્ધ થઈ જાય છે. આ રીતે શુદ્ધ કરેલું સોનું નેશનલ, પાટલો વગેરે કરતાં ઘણી ઊંચી જાતનું હોય છે.

**અર્થ :-**—તત્ત્વશ્રદ્ધાન થતાં સ્વ-પર ગુણની ઓળખાણ થઈ જેથી પોતાના નિજ ગુણ સમ્યગ્દર્શન, શાન, ચારિત્રમાં પરિષમન કર્યું છે, નિર્મળ ભેદ-વિજ્ઞાન થવાથી ઉત્તમ વિશ્રામ મળ્યો અને પોતાના સ્વરૂપમાં જ પોતાનો સહાયક ગોતી લીધો. પં. બનારસીદાસજી કહે છે કે આ પ્રયત્નથી પોતાની મેળે જ વિભાવ પરિષમન નાણ થઈ ગયું અને શુદ્ધ આત્મા એવો પ્રકાશિત થયો જેમ રસાયણમાં સોનાના પતા પકાવવાથી તે ઉજ્જવળ થઈ જાય છે. ૩૪.

વસ્તુસ્ત્વભાવની પ્રાપ્તિમાં નટીનું દૃષ્ટાંત (સવૈયા એકત્રીસા)

જैસેં કોऊ પાતુર બનાય વસ્ત્ર આભરન,  
આવતિ અખારે નિસિ આડો પટ કરિંકે।  
દુહું ઓર દીવાટિ સંવારિ પટ દૂરિ કિજે, ૧૮  
સકલ સભા કે લોગ દેખે દૃષ્ટિ ધરિંકે॥  
તૈસેં ગ્યાન સાગર મિથ્યાતિ ગ્રંથિ ભેદ કરિ,  
ઉમગ્યૌ પ્રગટ રહ્યૌ તિહું લોક ભરિંકે।  
એસૌ ઉપદેસ સુનિ ચાહિએ જગત જીવ,  
સુદ્ધતા સંભારૈ જગ જાલસૌં નિસરિંકે॥૩૫॥

મજ્જનું નિર્ભરમમી સમમેવ લોકા  
આલોકમુચ્છલતિ શાન્તરસે સમસ્તાઃ ।  
આજ્ઞાબ્ય વિભ્રમતિરસ્કરિણીં ભરેણ  
પ્રોન્મગન એષ ભગવાનવવોધસિન્ધુઃ ॥૩૨॥

**શાલાર્થ :-** પાતુર(પાત્રા)=નટી, નાચનારી. અખારે=નાટ્યશાળામાં. નિશિ=રાત્રિ. પટ=વસ્ત્ર. ગ્રંથિ=ગાંઠ. નિસરિકેં=નીકળીને.

**અર્થ :-** જેમ નટી રાત્રે વખ્તાભૂષણોથી સજજ થઈને નાટ્યશાળામાં પડદાની પાછળ આવીને ઊભી રહે છે તો કોઈને દેખાતી નથી, પરંતુ જ્યારે બજે તરફના દીવા ઠીક કરીને પડદો ખસેડી લેવામાં આવે છે તો સભાના બધા માણસોને સ્પષ્ટપણો દેખાય છે, તેવી જ રીતે જ્ઞાનનો સમુદ્ર આત્મા જે મિથ્યાત્વના પડદામાં ઢંકાઈ રહ્યો હતો તે પ્રગટ થયો જે ત્રણલોકનો જ્ઞાયક થશે. શ્રીગુરુ કહે છે કે હે જગતના જીવો! આવો ઉપદેશ સાંભળીને તમારે જગતની જળમાંથી નીકળીને પોતાની શુદ્ધતાની સંભાળ કરવી. ઉપ.

એ પ્રમાણે રંગભૂમિકા પૂર્ણ થઈ.

### પ્રથમ અધિકારનો સાર

આત્મપદાર્થ શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ, દેહાતીત, ચિચ્ચયમતકાર, વિજ્ઞાનધન, આનંદકંદ, પરમદેવ સિદ્ધસમાન છે. જેવો તે અનાદિ છે તેવો અનંત પણ છે અર્થાત્ ન તે ઉત્પન્ન થયો છે અને ન કદી નાચ પણ થશે. જો કે તે પોતાના સ્વરૂપથી સ્વચ્છ છે પરંતુ સંસારી દશામાં જ્યારથી તે છે ત્યારથી અર્થાત્ અનાદિકાળથી શરીરથી સંબંધ છે અને કર્મકાલિમાથી મલિન છે. જેમ સોનું ખાણાની અંદર કાદવ સહિત રહે છે પણ ભડીમાં તપાવાથી શુદ્ધ સોનું થઈ જાય છે અને કાલિમા જુદી થઈ જાય છે તેવી જ રીતે સમ્યકૃતપ-મુખ્યપણો શુક્લધ્યાનની અનિ દ્વારા જીવાત્મા શુદ્ધ થઈ જાય છે અને કર્મકાલિમા જુદી થઈ જાય છે. જેવી રીતે જીવેરી કાદવવાળા સોનાને ઓળખીને સોનાની કિંમત દે-લે છે તેવી રીતે જ્ઞાનીઓ અનિત્ય અને મળથી ભરેલા શરીરમાં પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમય પરમાત્માનો અનુભવ કરે છે.

જ્યારે કપડા ઉપર મેલ જામી જાય છે ત્યારે મલિન કહેવાય છે, લોકો તેનાથી જ્લાનિ કરે છે અને નિરૂપયોગી બતાવે છે, પરંતુ વિવેક દાસ્તિથી વિચારવામાં આવે તો કપડું પોતાના સ્વરૂપથી સ્વચ્છ છે, સાબુ-પાણીનું નિમિત્ત જોઈએ. બસ! મેલસહિત વખ્તની જેમ કંઈમસહિત આત્માને મલિન કહેવો એ વ્યવહારનયનો વિષય છે અને મેલથી જુદા સ્વચ્છ વખ્તની જેમ આત્માને કર્મકાલિમાથી જુદો જ ગણવો તે

નિશ્ચયનયનો વિષય છે. અભિપ્રાય એ છે કે જીવને ખરેખર કર્મકાળિમા લાગતી નથી. કપડાના મેલની જેમ તે શરીર આદિથી બંધાયો છે, ભેદવિજ્ઞાનરૂપ સાબુ અને સમતારસરૂપ જળ દ્વારા તે સ્વર્ચ થઈ શકે છે. તાત્પર્ય એ છે કે જીવને દેહથી ભિન્ન શુદ્ધ-બુદ્ધ જ્ઞાનાર નિશ્ચયનય છે અને શરીરથી તન્મય રાગ-દ્રેષ્ટ્રોહથી મલિન, કર્મને આધીન કહેવાવાળો વ્યવહારનય છે ત્યાં પ્રથમ અવસ્થામાં આ નયજ્ઞાન દ્વારા જીવની શુદ્ધ અને અશુદ્ધ પરિણાતિને સમજીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીન થવું અનું જ નામ અનુભવ છે. અનુભવ પ્રાત થયા પછી નયોનો વિકલ્પ પણ રહેતો નથી તેથી કહેવું પડશે કે નય પ્રથમ અવસ્થામાં સાધક છે અને આત્માનું સ્વરૂપ સમજ્યા પછી નયોનું કામ નથી.

ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. જીવના ગુણ ચૈતન્ય, જ્ઞાન, દર્શન આદિ છે. દ્રવ્યની હાલતને પર્યાય કહે છે. જીવની પર્યાયો નર, નારક, દેવ, પશુ આદિ છે. ગુણ અને પર્યાયો વિના દ્રવ્ય હોતું નથી અને દ્રવ્ય વિના ગુણ પર્યાય હોતા નથી. તેથી દ્રવ્ય અને ગુણ-પર્યાયોમાં અવ્યતિરિક્ત ભાવ છે. જ્યારે પર્યાયને ગૌણ અને દ્રવ્યને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે ત્યારે તે નય દ્રવ્યાર્થિક કહેવાય છે અને જ્યારે પર્યાયને મુખ્ય તથા દ્રવ્યને ગૌણ કરીને કથન કરવામાં આવે છે ત્યારે તે નય પર્યાયાર્થિક કહેવાય છે. દ્રવ્ય સામાન્ય હોય છે અને પર્યાય વિશેષ હોય છે, તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષયમાં સામાન્ય-વિશેષનું અંતર રહે છે. જીવનું સ્વરૂપ નિશ્ચયનયથી આવું છે, વ્યવહારનયથી આવું છે, દ્રવ્યાર્થિકનયથી આવું છે, પર્યાયાર્થિકનયથી આવું છે, અથવા નયોના ભેદો શુદ્ધ નિશ્ચયનય, અશુદ્ધ નિશ્ચયનય, સદ્ભૂત વ્યવહારનય, અસદ્ભૂત વ્યવહારનય, ઉપયરિત વ્યવહારનય ઈત્યાદિ વિકલ્પ ચિત્તમાં અનેક તરંગો ઉત્પન્ન કરે છે, એનાથી ચિત્તને વિશ્રામ નથી મળી શકતો, તેથી કહેવું જોઈએ કે નયના કલ્લોલ અનુભવમાં બાધક છે પરંતુ પદાર્થનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનવા અને સ્વભાવ-વિભાવને ઓળખવામાં સહાયક અવશ્ય છે. તેથી નય, નિક્ષેપ અને પ્રમાણથી અથવા જેમ બને તેમ આત્મસ્વરૂપની ઓળખાજા કરીને સદૈવ તેના વિચાર તથા ચિંતવનમાં લાગ્યા રહેવું જોઈએ.

